



# ગુજરાત જાહેર સેવા આયોગ

## ૧૧ માસ માટે કરાર આધારિત જગ્યા ભરવા માટેની જાહેરાત

ગુજરાત જાહેર સેવા આયોગની કચેરીમાં જા.ક. ૨૨/૨૦૨૧-૨૨ કાયદા અધિકારી, વર્ગ-૨ ની જગ્યા માટે તા. ૨૮/૦૭/૨૦૨૧ ના રોજ ૧૩:૦૦ કલાકથી તા. ૧૨/૦૮/૨૦૨૧ ના રોજ ૧૩:૦૦ કલાક સુધી <https://gpsc-ojas.gujarat.gov.in> પર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

(૧) કાયદા અધિકારી, વર્ગ-૨ ની ૦૧ (એક) જગ્યા રૂ. ૪૦,૦૦૦/- ના માસિક ફિક્સ પગારથી કરાર આધારિત ૧૧ માસ અથવા આ જગ્યા જ્યાં સુધી નિયમિત નિમણૂકથી ભરાય ત્યાં સુધીનો આ સમયગાળો એ બે માંથી જે વહેલું હોય, તેટલા સમય માટે તદ્દન હંગામી અને કરારના ધોરણે ભરવા માટે નીચે દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

### ઉંમર અને શૈક્ષણિક લાયકાત :-

(a) Age : Not be more than 41 years of age ;

(b) Educational Qualification : Possess a degree in law (Special) or L.L.B. (three years) or Degree in Law (integrated) of five years course obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in India or any other educational institution recognised as such or declared to be a deemed as university under section 3 of the University Grants Commission Act, 1956 and

### (c) Experience :

(i) Have at least three years of active and continuous experience as an advocate and such experience certificate shall be certified in case of an advocate practicing in the High Court by the Registrar General and in other case by the Presiding Officer of the court or the Tribunal where he practices as an advocate; or

(ii) Have at least three years experience of legal matters in the Government/ Local Bodies/ Government undertaking/ Board/ Corporation/ University/ Limited Companies established under the Companies Act, 2013.

(d) Computer Literacy : Possess the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Service Classification and Recruitment Rules, 1967 and

(e) Language Knowledge: Possess adequate knowledge of English and Gujarati or Hindi or both.

### કાયદા અધિકારી, વર્ગ-૨ ની જગ્યા માટે વય મર્યાદામાં નીચે મુજબ છૂટછાટ મળી શકશે.

Upper age limit shall be relaxed by 05 years for women candidates and for the physically disabled candidates maximum by 10 years subject to his/her ability to discharge duties to the posts, as may be performed by any other normal person, on the basis of production of medical certificate prescribed by G.A.D. circular dated 01-12-2008 from the medical board. Upper age limit shall be relaxed for Gujarat Govt. employee as per rules.

### (૨) અરજી અંગેની સૂચનાઓ :

૧. વર્ગ-૧ ના અધિકારી દ્વારા અપાયેલ સારા ચારિત્ર્ય અંગેનું પ્રમાણપત્ર અસલમાં રજૂ કરવાનું રહેશે.

૨. ઉમેદવારની પસંદગી માટે મળેલ અરજી વિચારણામાં લેવાની તથા નિમણૂક સંબંધે આ માટે રચાયેલ નિમણૂક સમિતિનો નિર્ણય આખરી ગણાશે તેમજ ૧૧ માસના કરાર આધારિત જોગવાઈઓ સંબંધિત લાગુ પડતી તમામ શરતો આ કરાર આધારિત પસંદગી/નિમણૂકને લાગુ પડશે.

૩. કાયદા અધિકારી, વર્ગ-૨ ના ભરતી નિયમો ઘડવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. આથી ઉપર દર્શાવ્યા મુજબની સૂચિત જોગવાઈઓ અનુસાર કરાર આધારિત જગ્યા ભરવામાં આવશે અને ભરતી નિયમોને આધિન રહેશે.

તારીખ: ૨૭/૦૭/૨૦૨૧